



I B Patel English School (Primary)

2020 -2021

Class - 4

Exercise

Subject – Gujarati

Chapter : 1 તમે શું ખાશો?

૫) વાતચીત

૧) બધાને કકડીને ભૂખ કેમ લાગી હતી?

જ) બધા તૈયાર થવામાં સવારનો નાસ્તો કરવાનું ભૂલી ગયા હતા.તેથીબધાને ભૂખ લાગી હતી.

૨) તમને કકડીને ભૂખ ક્યારે લાગે છે?

જ) અમે સવારે નાસ્તો ન કર્યો હોય તો ભૂખ લાગે છે.

૩) ભીમને શાની ચિંતા થઈ?

જ) ઝૂમરું જોકર બધી રસોઈ છૂમંતર કરી દેશે તો બધા શું ખાશે? તેની ભીમને ચિંતા થઈ.

૪) સાતમી ચપટીએ સિંહ આવ્યો, ત્યારે કોને બીક નહીં લાગી હોય?

જ) સાતમી ચપટીએ સિંહ આવ્યો, ત્યારે લોમડીને બીક નહીં લાગી હોય.

૫) જીમી સિંહ આવ્યો ત્યારે બધાએ બૂમાબૂમ શા માટે કરી?

જ) જીમી સિંહ પ્રાણીઓને મારીને તેમનો જ નાસ્તો ન કરી જાય તેથી બધાએ બૂમાબૂમ કરી.

પ્રશ્ન ૬), ૭), ૮), ૧૦), ૧૧) વિદ્યાર્થીઓએ જાતે કરવો

૧૪) ચાલો, બનાવીએ લીંબુ શરબત :

૩) બનાવવાની રીત :

જ) એક તપેલીમાં પાણી લીધું. પછી તેમાં લીંબુ નિચોવ્યું અને તેમાં ખાંડ, મીઠું, જીરું નાખ્યું.પછી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવ્યા કર્યું. પછી એક પ્યાલામાં કાઢી લીધું.

૧૫) વાનગી કેવી લાગે? ઉદાહરણ પ્રમાણે લખો:

વાનગી	કેવી લાગે?	વાનગી	કેવી લાગે?
હલવો -	મીઠો મીઠો હલવો	બટકાવડા -	તીખા બટકાવડા
પાપડ -	તીખો પાપડ	મધ -	મીઠું મધ
બુંદી -	મીઠી બુંદી	મેથીપાક -	કડવો મેથીપાક
ચેવડો -	તીખો ચેવડો	દૂધપાક -	મીઠો દૂધપાક
ઢોસા -	તીખા ઢોસા	આઈસ્ક્રીમ -	મીઠો આઈસ્ક્રીમ
રસગુલ્લા -	મીઠા રસગુલ્લા	કઢી -	ખાટી-મીઠી કઢી

૧૬) વિદ્યાર્થીઓએ જાતે કરવો

૧૭) શામાંથી શું બને?

દૂધમાંથી	-	દહીં, છાશ, માખણ, બરફી, ઘી, ખીર, કુલ્ફી
ઘઉંમાંથી	-	રોટલી, શીરો, કંસાર, પૂરી, લાડવા
કેરીમાંથી	-	શાક, અથાણું, છૂંદો, શરબત, મુરબ્બો
મકાઈ	-	ભેળ, વડા, રોટલા, શાક
બટાકા	-	શાક, બટાકાવડા, સમોસા, સૂકી ભાજી, વેફર, ચેવડો, પરોઠા
ચણામાંથી	-	શાક, પાણીપુરી, અથાણું
ચોખા	-	ભાત, પુલાવ, ખીચડી, રોટલા, પાપડ, પાપડીનો લોટ
બાજરી	-	રોટલા, ઢેબરા, લોટ,

૧૮) સાચું-ગખ્પું, ગખ્પું- સાચું

સાચું હોય તેને ગખ્પું બનાવો, ગખ્પું હોય તેનું સાચું વાક્ય બનાવો લખો:

- ૧) એક મોટા જંગલમાં નાનકડી કીડી રહેતી હતી.
એક નાનકડું જંગલ મોટી કીડીમાં રહેતું હતું.
- ૨) ઊડતી રેલગાડીમાં ટીકુની પતંગ ફસાઈ.
ઊડતી પતંગમાં ટીકુની રેલગાડી ફસાઈ.
- ૩) વરસાદમાં નાહવાનો કંટાળો આવે છે.
વરસાદમાં નાહવાનું ખૂબ ગમે છે.
- ૪) મારા પગ નીચે હાથી દબાઈ ગયો.
હાથી નીચે મારો પગ દબાઈ ગયો.
- ૫) મારી કાર પાણીથી ચાલે છે.
મારી કાર પવનથી ચાલે છે.
- ૬) મને મચ્છર કરડે છે.
હું મચ્છરને કરડું છું.
- ૭) પંખીઓ આકાશમાં ઊડે છે.
પ્રાણીઓ આકાશમાં ઊડે છે.
- ૮) આકાશમાંથી દૂધપાકનો વરસાદ વરસ્યો.
આકાશમાંથી ઘોઘમાર વરસાદ વરસ્યો.
- ૯) મેં આંબા પરથી કેરી તોડીને ખાધી.
મેં આંબા પરથી દ્રાક્ષ તોડીને ખાધી.
- ૧૦) ઊડતાં ઊડતાં બગલો પોતાની પાંખ પર સૂઈ ગયો.
ઊડતાં ઊડતાં બગલો એક ઝાડ પર સૂઈ ગયો.

૧૯) વાક્યો મોટેથી વાંચો:

- ૧) મને દૂધ ભાવે છે.

- ૨) કાકીએ કેરી કાપી.
- ૩) ચાલ, બધાને જમવા બોલવું.
- ૪) ઝૂમરુંએ આઠમી ચપટી વગાડી.
- ૫) બધાને કકડીને ભૂખ લાગી હતી.